


મહીસાગર જિલ્લો



- ❖ સીમાઓ :- મહીસાગર જિલ્લો ઉત્તરે રાજસ્થાન રાજ્ય, દક્ષિણમાં પંચમહાલ અને ખેડા પૂર્વમાં દાહોદ, અને પશ્ચિમમાં અરવલ્લી જિલ્લાની સરહદો આવેલી છે.
- ❖ પંચમહાલ અને ખેડા જિલ્લાના અમુક તાલુકાને છુટા પાડીને નવી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી છે.
- ❖ મુખ્ય મથક :- લુણાવાડા
- ❖ ક્ષેત્રફળ :- ૨,૫૫.૭૪૦ કિમી.
- ❖ સ્થાપના :- ૨૬/૧/૨૦૧૩
- ❖ વિધાનસભાની કુલ સીટો :- ૨
- ❖ વસ્તી :- ૧,૧૯,૭૧૩
- ❖ ગામડાઓ :- ૪૮૦ (બાલાસિનોર(૪૬), લુણાવાડા(૮૩), કડાણા(૧૩૬), વીરપુર(૫૪), ખાનપુર અને સંતરામપુર(૧૫૧)
- ❖ ગ્રામ પંચાયત :- ૭૧૫
- ❖ સાક્ષરતા :- ૬૧.૮૩%
- ❖ પીનકોડ નં. :- ૩૮૮૨૫૫
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન
- ❖ આરટીઓ નંબર :- GJ-35
- ❖ તાલુકાઓ :- ૬ (બાલાસિનોર, લુણાવાડા, કડાણા, વીરપુર, ખાનપુર અને સંતરામપુર)
- ❖ તાલુકા પંચાયતની કુલ સીટો :- ૬ (બેઠકો-૧૨૬) લુણાવાડા-૨૬, કડાણા-૨૦, ખાનપુર-૧૬, સંતરામપુર-૧ અને વીરપુર-૧૮)
- ❖ જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૮
- ❖ હવાઈમથક :-
- ❖ બંદરો :-

- ❖ લિંગ પ્રમાણ :-
- ❖ પર્વતો:- વરઘાટીની ટેકરીઓ, વિધ્યાંચલની ટેકરીઓ
- ❖ નદીઓ :-ભાદર,શેઢી, લૂણી, મહી અને પાનમ
- ❖ જળધોધ :- સાતકુંડા ધોધ
- ❖ તળાવ :- ડારકોલી તળાવ, કનકા તળાવ (લુણાવાડા)
- ❖ વાવ:- સાસુવહુની વાવ (લવાણા)
- ❖ પેલેસ :- નવાબનો ગાર્ડન પેલેસ (બાલાસિનોર)
- ❖ જળાશય ડેમ :- કડાણા ડેમ (મહીનદી) ,પાનમ ડેમ અને વણાકબોરી ડેમ (મહી નદી)
- ❖ મુખ્ય પાકો :- મકાઈ,બાજરી,ડાંગર,તુવેર, જવ, ડુંગળી અને તમાકુ
- ❖ ઉદ્યોગો :- ટર્બાઈન,હળવા વાહનો,ઓટોમોબાઈલ
- ❖ ખનીજ :- સિલિકા, ગ્રેનાઈટ,ગ્રેવલ, બ્લેક ટ્રેપ,લાઈમસ્ટોન
- ❖ વિવિધ વિષય ની માહિતી અને રેગ્યુલર ફ્રી ટેસ્ટ, કરંટ અફેર્સ વગેરે માટે આજે જ ડાઉનલોડ કરો Gnan Bhandar મોબાઈલ એપ્લિકેશન
- ❖ રાજ્યકક્ષાનું વન:- ગોવિંદ ગુરુ સ્મૃતિ વન (માનગઢ-૨૦૧૨)
- ❖ જોવાલાયક સ્થળો :- જુરાસિક પાર્ક (બાલાસિનોર),માનગઢ હિલ, ગાર્ડન પેલેસ,લૂણેશ્વર મહાદેવનું મંદિર
- ❖ મેળો :- રેવડીનો મેળો, કાલેશ્વરીનો જન્માષ્ટમીનો મેળો

વિશેષ નોંધ

- ❖ આ જિલ્લાની મોટાભાગની વસ્તી આદિવાસી છે.
- ❖ મહીસાગર જિલ્લાનો બાલાસિનોર તાલુકાનું રૈયાલીમાં ઈ.સ. 1983માં પ્રાગૈતિહાસિક કાળના ડાયનાસોરના ઈંડા મળી આવ્યા હતા.
- ❖ રૈયાલી વિશ્વની ત્રીજી સૌથી મોટી ડાયનોસોર ફોસિલ વસાહત માનવામાં આવે છે.
- ❖ મહી નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને રાજસ્થાનના વાગડ વિસ્તારમાં થઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે અને અરબી સમુદ્રમાં ભળી જાય છે.
- ❖ મહીસાગર જિલ્લાના માનગઢ હિલ ખાતે 17 નવેમ્બર 1913માં અંગ્રેજોએ 1500થી વધુ ભીલ આદિવાસીઓની હત્યા કરી હતી જે માનગઢ હત્યાકાંડ ને ગુજરાતનો 'જલિયાંવાલા બાગ હત્યાકાંડ' કહેવામા આવે છે.
- ❖ સંતરામપુર ખાતે સૂફી નદીના કિનારે પ્રતાપપુરા વિસ્તારમાં જૈન સંપ્રદાયનો રેવડીનો મેળો ત્રણ દિવસ ભરાય છે. સંતરામપુરમાં આદિવાસી પ્રજા તથા દિગંબર જૈન સમાજની સંસ્કૃતિના સમન્વયરૂપ રવેચીનો મેળો યોજાય છે.
- ❖ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ગોકુળ આઠમના દિવસે કાલેશ્વરીમાં કાલેશ્વરીનો જન્માષ્ટમીનો મેળો ભરાય છે. જે પન્નાલાલ પટેલની નવલકથા 'મળેલાજીવ'ના પાત્રો કાનજી અને જીવીના પ્રથમ મિલનનો આ મેળો સાક્ષી છે.પન્નાલાલ પટેલની નવલકથા જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તે સુપ્રસિદ્ધ નવલકથા માનવીની ભવાઈ પરથી બનેલ ગુજરાતી ફિલ્મ ' માનવીની ભવાઈ'નું શૂટિંગ અહીં થયું હતું.